

## કલમ-૪(૧)(બી)(૨) : સંસ્થાનાં અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

### ૧. સેક્શન ઓફિસર

- સેક્શન ઓફિસરના ડી.પી.ઓર્ડર હેઠળ સુપ્રત થયેલી તમામ કામગીરી.
- ખાતાના વિભાગીય વડા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રીના સંકલનમાં રહીને વખતો વખત મળતી સુચના/ખાતાને લગતી કામગીરી કરાવવી.
- સમગ્ર ખાતાનો વહીવટ સુગમ અને સરળ રીતે ચાલે તે જોવાની જવાબદારી તથા રેકર્ડ ખાતાનાં કર્મચારીઓને કામની સૌંપણી કરી કામગીરી કરાવવી તથા માર્ગદર્શન આપવું.
- રેકર્ડ વિભાગ દ્વારા અરજદારોને આપવામાં આવતાં ઠરાવની નકલ તેમજ પ્રમાણપત્રોને પ્રમાણિત કરવા.
- અલગ અલગ ઝોન/વિભાગ/ખાતાને ઉપયોગમાં લેવાના વિવિધ રજીસ્ટરો, રસીદ પુકો, ફોર્મ્સ વિગેરે સ્ટેશનરી અને બુકોના રજીસ્ટ્રેશનોની કામગીરી કરવી.

...૨...

- દરવર્ષ જે તે વિભાગના નવા રજીસ્ટરોની રજીસ્ટ્રેશનની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરી જે તે વિભાગને પુરા પાડવા.
- રાઈટ ટુ ઈન્ફર્મેશન એકટ હેઠળની માહિતી અંગે અપીલ અધિકારી તરીકેની કામગીરી.
- નાગરિક અધિકાર પત્ર હેઠળ જાહેર જનતાને માહિતી પુરી પાડવી.
- હાજરીપત્રક મેઈન્ટેઇન કરવું તેમજ શિક્ષા અંગેની કામગીરી.
- તાબા હેઠળના કર્મચારીઓની રજા, પગાર વધારાનો ઈજાફો મંજૂર કરવા.
- કર્મચારીઓના ગુપ્ત અહેવાલ તૈયાર કરાવવા તથા જે તે કર્મચારીઓના ગુપ્ત અહેવાલનું ગેડીંગ કરાવવું.
- વયમર્યાદા/સ્વૈચ્છિક નિવૃત થયેલ કર્મચારીઓના ગ્રેજ્યુલ્ટી/એડી ગ્રેજ્યુલ્ટી/પેન્શન ચુકવણી અંગેની ફાઈલ તૈયાર કરાવી નાણાં ચુકવણી અંગે કાર્યવાહી કરાવવી.
- ઓડીટ ઓફિસર એકટને લગતી કામગીરી કરાવવી અને અન્ય વિવિધ પ્રકારની કામગીરી પર દેખરેખ રાખી ખાતામાં કરવામાં આવતા તમામ પ્રકારના કામો ઝડપી, સુગમ અને સરળ રીતે થાય તેના પર દેખરેખ રાખવી.
- ખાતાના વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ્સનું નિયમોનુસાર રેકર્ડ રૂલ્સ ૧૯૬૫ મુજબ A,B,C,D,E કેટેગરીમાં **ફકત વર્ષવાર** વર્ગીકરણ કરાવી નાશ/જમા કરાવવા સુધીની કામગીરી કરાવવી.

### ૨. પ્રથમ શ્રેણી કલાક

- તમામ દફતરી તથા અન્ય અગત્યની કામગીરીની કાર્યવાહી સેક્શન ઓફિસરશ્રીના સંકલનમાં રહીને કરવી.
- રજીસ્ટ્રેશન કરવામાં આવતી બુકોની રજીસ્ટ્રેશન કાર્યવાહી થયેથી ચકાસણી કરવી.
- આરટીઆઈ એકટ હેઠળ આવતી અરજીઓના નિકાલની કામગીરી કરવી તથા આરટીઆઈ એકટ- ૨૦૦૫ અન્વયે જાહેર માહિતી અધિકારી તરીકે ફરજ બજાવવાની રહેશે.
- "નાગરિક અધિકાર પત્ર" એકટ હેઠળ જાહેર જનતાને પુરી પાડવાની માહિતી તૈયાર કરવી.
- બજેટ, એસ્ટાભ્લીશમેન્ટ, શીડ્યુલ વિગેરે કામગીરી.
- વાર્ષિક અહેવાલ તૈયાર કરવો.
- જનરલ એડવાન્સ રીકુપમેન્ટની કામગીરી.
- ખાતાની જરૂરિયાત મુજબ ટેન્ડરો બહાર પાડવાની કામગીરી.
- ખાતા દ્વારા કરાવવામાં આવતા કામોના વિવિધ પ્રકારના બીલોની ચકાસણી કરવા અંગેની કામગીરી.
- ખાતા દ્વારા વેચાણ કરવામાં આવતાં ફોર્મ્સ/પ્રકાશનોના વેચાણની ઉપજ-ટેન્ડર ફી વિ. હિસાબી

ખાતામાં જમા કરાવવી.

- સેક્શન ઓફિસરશ્રીના સંકલનમાં રહી રેકર્ડ વિભાગના તમામ પ્રકારના રેકર્ડનું ફક્ત વર્ષવાર વર્ગીકરણ કરી જાળવણી તેમજ નિભાવણીની કામગીરી કરવી તેમજ "નાશ પાત્ર રેકર્ડ" અંગે જરૂરી મંજુરી મેળવી નાશ/જમા કરાવવા અંગેની કામગીરી હાથ ધરવી.
- મુવમેન્ટ રજીસ્ટર નિભાવવું તેમજ સેક્શન ઓફિસરશ્રીની સુચના મુજબ કામગીરી તથા તમામ પ્રકારના સ્ટેશનરી છાપકામ લીસ્ટ અપડેટ કરાવવા.
- રેકર્ડ રૂલ્સ ૧૯૮૫ મુજબ દરેક ઝોન/ખાતામાંથી વર્ગીકરણ મુજબના રેકર્ડની ફક્ત વર્ષવાર ગોઠવણી કરવા તથા "નાશ કરવા/પાત્ર રેકર્ડ" ના નાશ કરવા/નિકાલ કરવા અંગેની કાર્યવાહી.
- પુસ્તક મેળાને લગતી આનુસંધિક કામગીરી.
- વયમર્યાદા/સ્વૈચ્છિક નિવૃત થયેલ કર્મચારીઓના ગ્રેજ્યુલ્ટી/એડિગ્રેજ્યુલ્ટી/પેન્શન ચુકવણી અંગેની ફાઈલ તૈયાર કરી નાણાં ચુકવણી અંગે ઘટિત કાર્યવાહી કરવી.
- કર્મચારી/અધિકારીશ્રીના મહેકમની દેખરેખ/રજા/ પગાર વધારાનો ઈજાફો મંજુર કરાવવી.

...તે...

### ૩. ત્રીજી શ્રેણી કલાક

- દરેક ખાતા / ઝોનમાં વપરાતી દરેક પ્રકારની બુકો, રજીસ્ટરો, ફોર્મ, હાજરીપત્રક વિગેરે નોંધણી કરવા અંગેની કામગીરી.
- રજીસ્ટ્રેશન કરી નોંધણી રજીસ્ટર તથા ઈસ્યુ રજીસ્ટર નિભાવવાની કામગીરી.
- આઉટવર્ડ/ઈનવર્ડ ડિસ્પેચને લગતી તમામ કામગીરી .
- વિવિધ પ્રકાશનો—ફોર્મ્સ વિગેરેનું વેચાણ અંગેની કામગીરી.
- ઝોન/ખાતામાંથી આવેલ વર્ગીકરણ મુજબના રેકર્ડની ફક્ત વર્ષવાર ગોઠવણી કરવા તથા "નાશ પાત્ર રેકર્ડ" નાશ કરવા/નિકાલ કરવા સંદર્ભની કાર્યવાહી.
- જાહેરાતના ફોર્મ, પ્રિન્ટેડ રેકર્ડ, ભરણું તથા બહારના અરજદારો ધ્વારા માંગવામાં આવતા ઠરાવો તથા વસ્તીના આંકડાઓની નકલ પૂરી પાડવી, ડિસ્પેચ, એસ્ટાબ્લીશમેન્ટ, જનરલ રજીસ્ટરોની નોંધણી અંગેની કામગીરી.
- મેગેજીનાં બીલો/કુરીયરના બીલો/વેપારી બીલો તથા અન્ય પ્રકારના બીલો મ્યુ.પ્રેસ વિભાગમાં મળ્યેથી સદર બીલોની સમયઅવધિમાં ચકાસણી કરાવીને ચુકવણી કરાવવા સુધીની કામગીરી.

### ૪. બુક બાઈન્ડર

- રેકર્ડ/ગોઝેટ વગેરે બાઈન્ડીંગની કામગીરી.

### ૫. પટાવાળા

- ઓફિસને લગતી કામગીરી તેમજ ટપાલ વહેંચવાની કામગીરી કરવી.

### ૬. બેલદાર

- વિવિધ ઝોન / ખાતાઓ તરફથી મળેલ જુના રેકર્ડ સુચના મુજબ વ્યવસ્થિત રીતે ફક્ત વર્ષવાર ગોઠવાની તેમજ રેકર્ડ ઓફિસમાં સાફ્ટ-સફાઈ કરવાની કામગીરી કરવી.